

Statement of Audited Consolidated Financial Results for the Quarter and Year ended 31st March, 2021 (₹ in Lacs)

Particulars	Quarter ended 31.03.2021	Year ended 31.03.2021	Quarter ended 31.03.2020
1 Total income from operations	1,907.00	6,485.62	1,552.56
2 Net Profit / (Loss) for the period before Tax	229.19	770.74	142.30
3 Net Profit / (Loss) for the period after Tax	160.73	540.64	95.07
4 Total Comprehensive Income for the period	169.20	542.62	86.63
5 Equity Share Capital	342.45	342.45	342.45
6 Other Equity	--	3,111.72	--
7 Earnings per share of ₹ 1/- each			
(1) Basic	0.47	1.58	0.28
(2) Diluted	0.47	1.58	0.28

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com).

For **INTEGRA Engineering India Limited**
Shalin Sunandan Divatia
Director

Place : Mumbai
Date : 26.05.2021

Statement of Audited Standalone Financial Results for the Quarter and Year ended 31st March, 2021 (₹ in Lacs)

Particulars	Quarter ended 31.03.2021	Year ended 31.03.2021	Quarter ended 31.03.2020
1 Total income from operations	1,907.00	6,485.62	1,552.56
2 Net Profit / (Loss) for the period before Tax	229.19	770.74	142.30
3 Net Profit / (Loss) for the period after Tax	160.73	540.64	95.07
4 Total Comprehensive Income for the period	169.20	542.62	86.63
5 Equity Share Capital	342.45	342.45	342.45
6 Other Equity	--	3,111.72	--
7 Earnings per share of ₹ 1/- each			
(1) Basic	0.47	1.58	0.28
(2) Diluted	0.47	1.58	0.28

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com).

For **INTEGRA Engineering India Limited**
Shalin Sunandan Divatia
Director

Place : Mumbai
Date : 26.05.2021

TENDER NOTICE

Sealed tenders are invited from **manufacturer/supplier/traders** (having minimum three years' experience in machinery) for Supply of Machinery and equipment for Common Facilities Centre at village **Bagodara Village, Bavla Tal Ahmedabad Gujarat**, being facilitated by **Mahila Hastkala Welfare Federation A/6 Gurjar Ratan Apt, Radhaswami Road, Ranip, Ahmedabad Gujarat pin: 382480** Tender should be submitted in separate envelopes for Technical Bid with earnest money of Rs 2,39,760/- or Bid security declaration for tenders and Financial Bid can be deposited at the below mentioned address up to 02.00 PM of 17/06/2021. The Demand Draft of earnest money should be in the name of **Mahila Hastkala Welfare Federation** or Bid security declaration for tenders. Tenders received will be opened before the Procurement Committee of the proposed Common Facilities on 18/06/2021 at 2.00 PM. Tender form can be obtained from **Mahila Hastkala Welfare Federation A/6 Gurjar Ratan Apt, Radhaswami Road, Ranip, Ahmedabad Gujarat pin: 382480** on any working day between 27/05/2021 to 17/06/2021 from 10.00 AM to 5.00 PM and up to 12.00 Hrs. on 17/06/2021 by payment of Rs. 500/-

The details of works and Terms and Conditions are available in the Tender Form. **President Mahila Hastkala Welfare Federation A/6 Gurjar Ratan Apt, Radhaswami Road, Ranip, Ahmedabad Gujarat pin: 382480**, reserves the right to cancel any or all the Tenders without assigning any reason.

Pre bid Meeting 03/06/2021

MAHILA HASTKALA WELFARE FEDERATION
A/6 Gurjar Ratan Apt,
Radhaswami Road, Ranip,
Ahmedabad Gujarat pin: 382480
Email: mahilafederation2016@gmail.com
Contact: +91-8099718683



**Regional Office: Netaji Marg,
Nr. Mithakhali Six Roads,
Ellisbridge, Ahmedabad-6.
Phone: +91-79-26421671-75**

SYMBOLIC POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and exercise of powers conferred under section 13(12) read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the borrower(s), the guarantor(s) and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred upon him under sub-section (4) of Section 13 of the said Act read with Rule 8 of the said Rules on the date mentioned against each account.

The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the Bank for the for the amounts, interest, costs and charges thereon.

The borrower's/borrowers' attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

Name of borrower(s), the guarantor(s) & Loan Account No.	Description of the property mortgaged (Secured Asset)	Date of Demand Notice	Date of Symbolic Possession Notice	Outstanding Amt. as on Date of Demand Notice
Mr. Mukesh Madhu Mali Mrs. Ratnaben Mukeshbhai Mali Guarantor: Mr. Rajubhai Gorakhbhai Mahajan Loan A/c No. 311/ 4671	All that part and parcel of the immovable property situated at Revenue Survey No. 1, Block No. 1, Plot No. 51, Rahi Township Vibhag-5, Bs Rudraksh Residency, Moje Kareli, Kadodara Bardoli Road, At Kareli, Ta: Palsana, Surat, Gujarat- 394327 and which is bounded as follows: North: Plot No. 50 East: Society Road West: Plot No. 74 South: Plot No. 52	01.01.2021	20.05.2021	Rs. 8,58,495.36
Mr. Rameshbhai Laljibhai Gadhiya Mrs. Jayashriben Rameshbhai Patel Guarantor: Mr. Rajeshbhai Bholabhai Sorathiya Loan A/c No. 311/ 2595	All that part and parcel of the immovable property situated at Revenue survey No. 56, 57, 59, Block No. 130, Building No. D-3, Flat No. 403, Bhakti Dhara Residency, Sayan Gothan Road, Opp. Om Palace, Moje Sayan, Taluka-Olpad, Dist.- Surat, Gujarat- 394130 and which is bounded as follows: North: Open Space East: Flat No. 404 West: Building No. D/2 South: Flat No. 402	06.01.2021	20.05.2021	Rs. 4,16,541.05
Mr. Rajendrasinh Vasansinh Solanki Mrs. Phool Kunwar Vasansinh Solanki Guarantor: Mr. Pappu Pyarchand Kalal Loan A/c No. 314/2569	All that part and parcel of the immovable property situated at Revenue Survey No. 328, 329, Block No. 240, Plot No. 18, Devpooja Residency Vibhag-2, B/s Shiv Shlok Residency, Tanti Thaiya Gam, Tantithaiya, Palsana, Surat, Gujarat- 394305 and which is bounded as follows: North: Plot No. 19 East: Internal Road West: Plot No.45, 46 South: Plot No. 17	06.01.2021	20.05.2021	Rs. 11,83,673.65
Mr. Santosh Rajdhar Ramraje Mrs. Maya Santosh Ramraje Guarantor: Mrs. Anusaya Pramod Pawar Loan A/c No. 314/2784	All that part and parcel of the immovable property situated at Revenue Survey No. 198, Final Plot No. 46 Paiky Sub Plot No. 1, TP Scheme No. 54, Flat No. C/506, Bhagya Laxmi Residency, Bh. Shashi Roop Flats, Nr. Railway Over Bridge, Bhestan, Surat City, Surat, Gujarat- 395023 and which is bounded as follows: North: Flat No. 507 East: Building Passage West: Society Road South: Flat No. 503	01.01.2021	20.05.2021	Rs. 6,82,697.85
Mr. Vakkas Salimbhai Multani Mrs. Rasidabanu Salim Multani Loan A/c No. 307/3789	All that part and parcel of the immovable property situated at Revenue Survey No. 664, Tika No. 163, City Survey No. 6104, Plot No. 5, Flat No. 304, Wing- J, Karishma Gardens, Near Rangoon Nagar, Kamela Road, Navsari, Gujarat- 396445 and which is bounded as follows: East: Road West: Passage North: Flat No. 303 of Wing J South: Passage	01.01.2021	20.05.2021	Rs. 7,88,867.78

Place: Surat
Date: 27/05/2021

Authorised Officer
Bandhan Bank Limited



Office Building Complex, Bombay Market,
Surat Main Branch, Surat - 395010, Gujarat
email:-surat@tmbank.in Phone No.0261 2311272, 2368191

DEMAND NOTICE

Date: 17.05.2021
Notice dated 17.05.2021 issued to you u/s 13(2) of the Securitization & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002 by the Authorised Officer of Tamilnad Mercantile Bank Ltd., Surat Branch was sent to you calling upon to repay the dues in your loan accounts with us at your last known address which could not be served. Therefore, the contents of the said demand notice are being published in this newspaper.

- M/s. Carp Offset Borrower
Proprietor : Mr. Chirag R Talaviya,
S/o. Mr. Rameshbhai Dhirubhai Talaviya
Sy.no.189/1, plot No.7, Gala-1, vibhag-1, Hanuman Darwaja, B/h Sub Jail, Khatodara Surat - 395002
- Mr. Chirag R Talaviya Proprietor / Mortgagor
S/o. Mr. Rameshbhai Dhirubhai Talaviya
601, White Palace, Behind Nand Banglows Chorasi, Abrama Road, mola Varachha Surat 395006
- Mrs. Kajalben Rajeshbhai Talavia Guarantor / Mortgagor
W/o. Mr. Rajeshbhai Jaysukhbhai Talavia,
103, Ramvatika Banglows Part-5, Velanji, near Rangoli Chowk, Surat - 394150.
- Mr. Rajeshbhai Jaysukhbhai Talavia Guarantor
S/o. Jaysukhbhai Limbbhai Talaviya,
103, Ram Vatika Banglows Part-5, Velanji, Surat - 394150.
- Mr. Rameshbhai Dhirubhai Talaviya, Guarantor
S/o. Dhirubhai Shamjibhai Talaviya,
601, White Palace, Behind Nand Banglows Chorasi, Abrama Road, Mota Varachha, Surat 395006

Dear Sir/Madam
Sub: Demand Notice under Section 13(2) of the SARFAESI Act in respect of Loan Account No's- 119700460100516, 119700460100558 & 119700460100559 availed by M/s. Carp Offset at our Surat Branch and classified as non performing Asset.
At your request, the Bank has granted through its Surat Branch from time to time, various credit facilities to you as per the particulars mentioned in Schedule-A. You, the Borrowers have availed the credit facilities with an undertaking to repay the said credit facilities and executed the necessary loan documents in favour of the Bank and created charge in respect of movables shown in Schedule-B. Further Mr. Chirag R Talaviya, S/o. Mr. Rameshbhai Dhirubhai Talaviya and Mrs. Kajalben Rajeshbhai Talavia, W/o. Mr. Rajeshbhai Jaysukhbhai Talavia, have also created mortgage by way of deposit of title deeds in respect of the property more fully described in Schedule-C as security.
The liability in the above loan account were duly acknowledged by you by executing balance confirmation letters and revival letters and also other security documents from time to time. Further the loan account was personally guaranteed by Mrs. Kajalben Rajeshbhai Talavia, W/o. Mr. Rajeshbhai Jaysukhbhai Talavia, Mr. Rajeshbhai Jaysukhbhai Talaviya, S/o. Jaysukhbhai Limbbhai Talaviya, and Mr. Rameshbhai Dhirubhai Talaviya, S/o. Dhirubhai Shamjibhai Talaviya
Consequent to the default committed by the borrower/borrowers in repayment of the principal debt and interest thereon, the loan account, has been classified as Non-Performing Assets (NPA) on 31.03.2021 as per the directions/guidelines of Reserve Bank of India relating to asset classifications issued from time to time. Despite repeated requests you, the Borrowers have failed and neglected to repay the said dues/outstanding liabilities.

You, the Borrowers / Mortgagor/ Proprietor/Guarantors are hereby called upon by this Notice under Section 13(2) to discharge the liabilities in full to the bank and to repay a sum of **Rs. 2,48,80,990.00 (Rupees Two Crore Forty Eight Lakhs Eighty Thousand Nine Hundred Ninety Only)** loan accounts as on 30.04.2021 to the Bank within 60 days from date of this notice. You are also liable to pay future interest at 11.30% or BRR Plus 2% Penal Interest with monthly rests for Term Loan I and future interest at 11.40% or BRR Plus 2% Penal Interest with monthly rests for Term Loan II and Term Loan III on the aforesaid amount together with incidental expenses, cost, charges etc.
Bank will exercise all or any of the rights detailed under Sub-Section (4) of Section 13 and under other applicable provisions of the Act if you fail to repay the Bank the aforesaid amount with future interest and all costs and expenses thereon.
You, the Borrowers/Mortgagor/ Proprietor/Guarantors are restrained from transferring by way of sale, lease or otherwise, any of the above said assets more specifically mentioned in the schedule hereunder after issuance of this notice as per Section 13(13) of the above Act and any such transfer without prior written consent of the Bank will not affect the rights of the Bank and any such transfer shall be void.
The Borrowers/Guarantors/Mortgagors/ Proprietor attention is hereby invited to the provisions of sub-section 8 of Section 13 of the Act, in respect of time available to redeem the assets. Section 13(8) of the SARFAESI Act:-
Where the amount of dues of the secured creditor together with all costs, charges and expenses incurred by him is tendered to the secured creditor at any time before the date of publication of notice for public auction or inviting quotations or tender from public or private treaty for transfer by way of lease, assignment or sale of the secured assets-
i) the secured assets shall not be transferred by way of lease assignment or sale by the secured creditor and
ii) In case, any step has been taken by the secured creditor for transfer by way of lease or assignment or sale of the assets before tendering of such amount under this sub-section, no further step shall be taken by such secured creditor for transfer by way of lease or assignment or sale of such secured assets.
This notice is issued without prejudice to the Bank's right to initiate such other actions or legal proceedings as it deems necessary under any other applicable provisions of law.

Sr. No	Borrower Name	Nature of Facility with Account Number and Loan amount	Amount outstanding as on 30.04.2021	Date of Execution of Loan Documents / Last Renewal
1.	M/s. Carp Offset	Term Loan - I 119700460100516 Rs. 2,33,90,000.00	Rs. 2,27,67,042.00	30.03.2019
2.	M/s. Carp Offset	Term Loan - II 119700460100558 Rs. 12,00,000.00	Rs. 13,30,239.00	30.03.2020
3.	M/s. Carp Offset	Term Loan - III 119700460100559 Rs. 7,00,000.00	Rs. 7,83,709.00	30.03.2020
TOTAL			Rs. 2,48,80,990.00	

Sr. No	Description of the Machine	Qty	Supplier	Total Value
i	"Five Colors Sakurai Highpile Sheetfed Offset Press"	1	M/s. Inkwala's Inc, Ahmedabad	2,95,00,000/-
ii	"Pion" Make-3Phase-ISO-9001 Servo controlled voltage stabilizer 3 phase 4 wire 50 HZ	1	M/s. N.J. International, Surat	2,54,000/-
iii	Blue star make 3.0 TR ductable AC ceiling suspended (DSA-361)	3	M/s. Cooling Solution, Surat	4,67,000/-
iv	100KVA step down transformer 440 to 220 volt 3 ph. oil Cooled and PVC pipe, APFC panel	1	M/s. Twinkle Electricals, Surat	9,71,779/-
Total				3,11,92,779/-

- SCHEDULE-C**
1. (Description of Immovable properties)
1. On equitable mortgage of Residential plot No.67, R. S.No.306, Block No.289, land to the extent of 778.38 sq.ft at Amrutvill Vibhag-1, Near Gokuldham Society & Green avenue Resort, Nansard Road, Kamrej, Surat and house building constructed thereat ad-measuring to the extent of 557 sq.ft standing in the name of Mrs. Kajalben Rajeshbhai Talaviya
2. On equitable mortgage of residential land to the extent of 1217.17 sq.ft at R.S.No.94/2/2 & 113 Paikae, T.P.S.No.17 (Fulpada), F.P.No.135, C.T.S.No.6262, Plot No.D/51, Vallabh Nagar Society, Besides Mohan Nagar, Near Baroda Pristage, Off.Varacha Main Road, Fulpada, Tal.Puna (Surat City), Dist.Surat and House building constructed there at ad-measuring to the extent of GF 550 sq.ft., FF 909.97 sq.ft and SF 554.89 sq.ft (28.62 sq.mt & 22.95 sq.mt) standing in the name of Mr. Chirag Rameshbhai Talaviya

Yours faithfully,
V.Vasanthan, Authorised Officer,
Tamilnad Mercantile Bank Ltd., Surat Branch



FDC LIMITED

(CIN: L24239MH1940PLC003176)

Registered Office: Registered Office: B-8, M.I.D.C. Industrial Estate, Waluj - 431136, Dist. Aurangabad, Maharashtra
Tel. No. +91 240 255 4407, Website: www.fdcindia.com, Email: investors@fdcindia.com

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2021

(Rs. In lakhs)

Sr. No.	Particulars	Standalone					Consolidated				
		Quarter Ended (Audited)	Quarter ended (Unaudited)	Quarter Ended (Audited)	Year Ended (Audited)	Year Ended (Audited)	Quarter Ended (Audited)	Quarter ended (Unaudited)	Quarter Ended (Audited)	Year Ended (Audited)	Year Ended (Audited)
		31/03/2021	31/12/2020	31/03/2020	31/03/2021	31/03/2020	31/03/2021	31/12/2020	31/03/2020	31/03/2021	31/03/2020
1	Total Income from Operations	33,364.96	36,749.50	37,350.19	142,259.50	141,375.05	32,837.44	37,527.48	37,109.40	143,022.90	141,308.88
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	4,891.72	9,424.27	5,901.76	38,045.03	32,545.99	5,597.85	9,878.22	5,673.40	38,983.49	32,096.70
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	4,891.72	9,424.27	5,901.76	38,045.03	32,545.99	5,385.05	9,878.22	5,673.40	38,770.69	32,096.70
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	4,196.46	7,077.94	5,849.32	29,448.96	24,677.86	4,675.93	7,521.34	5,548.35	30,119.93	23,987.84
5	Total Comprehensive Income for the period (Comprising Profit / Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	4,546.96	7,301.37	5,527.82	30,054.95	24,322.23	5,084.36	7,674.95	5,241.02	30,593.86	23,663.97
6	Paid Up Equity Share Capital	1,688.10	1,688.10	1,709.73	1,688.10	1,709.73	1,688.10	1,688.10	1,709.73	1,688.10	1,709.73
7	Reserves excluding revaluation reserves as per Balance Sheet of Previous Accounting Year				170,528.43	152,472.12				171,725.39	153,033.23
8	Earning Per Share- (Rs. 1/- each) (for continuing and discontinued operations)										
	- Basic :	2.49	4.18	3.40	17.32	14.34	2.77	4.45	3.22	17.72	13.94
	- Diluted :	2.49	4.18	3.40	17.32	14.34	2.77	4.45	3.22	17.72	13.94

- Notes:**
1 The Financial Statements have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 and read together with the Companies (Indian Accounting Standards) Rules issued thereafter and other accounting principles generally accepted in India. The above is an extract of the detailed format of Quarterly/year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly/year ended Financial Results are available on the website of the Stock Exchange's (www.bseindia.com and www.nseindia.com) and on Company's website (www.fdcindia.com)
2 The above results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on May 26, 2021.

Dated : 26.05.2021
Place : Mumbai

For FDC LIMITED
Sd/-
Mohan A. Chandavakar
Managing Director
DIN: 00043344

